

*Before You Take your Dinner*

# રાતે ખાતાં પહેલાં

પ્રિયમુ

● પ્રેષક ●

શા. બાબુલાલ સરેમલજ

“સિદ્ધાચલ”, સેન્ટ એન્સ સ્કુલ પાસે, હીરા જૈન સોસાયટી,  
સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો. ૯૪૨૬૫૮૫૮૦૪

E-mail : [ahoshrut.bs@gmail.com](mailto:ahoshrut.bs@gmail.com)

## રાત્રિ બોજન

### WHY NOT ?

કોઈની હિંસા ન કરવી જોઈએ. જુદું ન બોલવું જોઈએ, ચોરી ન કરવી જોઈએ. આ આપણી મૂળભૂત સંસ્કૃતિના મહુત્વના પાસા છે. બરાબર એ જ રીતે એક મહુત્વનું પાસું છે રાત્રિભોજનત્યાગ. જેનો અર્થ છે - સૂર્યસ્તન બાદ બીજા દિવસના સૂર્યોદય સુધી ભોજન ન લેવું. આપણી મૂળભૂત સંસ્કૃતિ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે - એવું દુનિયાના અગ્રણી વિદ્વાનો સ્વીકારે છે. રાત્રિભોજન એ ત્યાજ્ય શા માટે ? આ વિષયમાં અહીં પ્રસ્તુત છે કેટલીક રસગ્રદ માહિતી.

\* યોગવિજ્ઞાન અને રાત્રિભોજન :- સાંજ પછી આપણા પાયન અવયવો ૨૦% જ કામ કરતાં હોય છે. માટે રાતે હળવો ખોરાક લેવામાં આવે તે પણ પાયનતંત્ર માટે ભારે સાબિત થાય છે. પછી અજીર્ણપ્રભવા રોગાઃ - રોગોનું મૂળ અજીર્ણ છે - એ ન્યાયે જાત જાતના રોગો શરીરમાં પ્રવેશ કરે છે. આધુનિક યોગાટ્રેઇનર્સ તો સાંજના ચાર વાગ્યા પછી પ્રવાહી સુદ્ધા લેવાનો નિષેધ કરે છે.

\* બોગવિજ્ઞાન અને રાત્રિભોજન :- નીતિવાક્યામૃતમ् નામના એક પ્રાચીન સંસ્કૃત ગ્રંથમાં જીવનસૂત્રોનો અદ્ભુત સંગ્રહ છે. આ ગ્રંથના એક જીવનસૂત્રમાં લખ્યું છે -

ભુક્તવા વ્યાયામવ્યવાયૌ સદ્ગો વ્યાપત્તિકારણમ्।

જમ્યા બાદ વ્યાયામ અને મૈથુનસેવન - આ બંને આરોગ્ય પર ભારે પ્રણાર કરે છે. અર્થાત્ ભોજન અને મૈથુન આ બે વચ્ચે લાંબો ગાળો ન હોય તો અવશ્ય સ્વાસ્થ્ય કથળે છે. રાત્રિભોજન કરનાર આ વિજ્ઞાનનું ઉલ્લંઘન કરે છે અને અનેક જાતની માંદગી વહોરી લે છે, તે સહજ છે.

\* નિદ્રાવિજ્ઞાન અને રાત્રિભોજન :- પેટ ભરેલું હોય અને પાયનક્ષિયાની રાતે ખાતાં પહેલાં \_\_\_\_\_ ૨ \_\_\_\_\_



શરૂઆત થઈ હોય, ત્યારે સામાન્યથી ઉંઘ ન આવે. અને જો એ સમયે ઉંઘ આવે તો પાચનક્કિયા ડિસ્ટર્બ થઈ જાય, અજીર્ણ દ્વારા અનેક રોગોને આમંત્રણ મળે. આનાથી બચવા માટે જો જાગરણ કરવામાં આવે તો ઉજાગરાને કારણે પાચનક્કિયા બગડે અને અજીર્ણ દ્વારા રોગો આવે. મોડા- ખૂબ મોડા સૂઈને પછી મોડા-ખૂબ મોડા ઉઠવું એ પણ નિદ્રાવિજ્ઞાનથી વિરુદ્ધ છે. શરૂઆતના ૮ થી ૧ સુધીના કલાકોની ગાઢ નિદ્રા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી હોય છે. જેની પૂર્તિ સવારના કલાકો કરી શકતા નથી. માટે જ આપણે ત્યાં એક કવિતા પ્રસિદ્ધ છે -

રાતે વહેલા જે સુવે, વહેલા ઉઠે વીર,  
બળ બુદ્ધિ બહુ ધન વધે, સુખમાં રહે શરીર.

આરોગ્ય માટે જરૂરી નિદ્રા રાત્રિભોજનને ટાળી દેવાથી જ મેળવી શકાય, એવું ફલિત થાય છે.

\* સૂર્યવિજ્ઞાન અને રાત્રિભોજન :- ભોજનને પચાવવા માટે ઓક્સિજન અત્યંત આવશ્યક છે. સૂર્યપ્રકાશ- તે લાઈટ શરીરને પૂરતાં પ્રમાણમાં ઓક્સિજન આપી શકે છે. સૂર્યપ્રકાશમાં અલ્ટ્રાવાવોલેટ કિરણો અને ઈન્ફારેડ કિરણો હોય છે. તે વાતાવરણને સૂક્ષ્મ જીવાણુઓથી મુક્ત રાખે છે. સૂર્યપ્રકાશ દરમિયાન ભોજન લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. રાત્રે સૂર્યપ્રકાશની ગેરહાજરીને કારણે લોહીમાં હોમોન્સની કમી થાય છે. પરિણામે માનસિક તથા શારીરિક તંત્રની ક્રિયાત્મકતા ઓછી થાય છે. અને દરેક અંગની કાર્યક્ષમતા ઘટી જાય છે. પાચનક્કિયા લાંબો સમય માંગી લે છે. અને મગજને પૂરતો લોહી-પૂર્વવઠો નહીં મળવાથી ગંભીર બિમારીઓ થઈ શકે છે. પાચનક્કિયા બરાબર ન થવાથી ગેસ ઉપર ચેતે છે અને અલ્સર વગેરે દંડની શક્યતા વધી જાય છે. સગર્ભાવસ્થામાં જે સ્વીઓ સૂર્યપ્રકાશથી દૂર રહે છે અને રાત્રિભોજન કરે છે, તેમના બાળકો પૂર્ણતઃ સ્વસ્થ નથી હોતાં.

\* ડાયાબિટીશ અને રાત્રિભોજન :- રાતે લેવાતાં ભોજનમાં લાળ



ભળતી નથી. તેથી લાગ્ના સાકર પચાવનારા અવયવો પર્યામ પ્રમાણમાં મળતા નથી. પરિણામે ડાયાબિટીસ થવાની સંભાવના વધે છે. વર્તમાન જીવન શૈલીમાં જેમ જેમ લેટ નાઈટ ડીનર્સ વધ્યા છે, તેમ તેમ ડાયાબિટીશના પેશાન્ટ્સ પણ વધ્યા છે.

દિવસે ભોજન લેવાથી લાગ વધુ થાય છે. ભોજન દ્વારા ટાયરોલીન અમીનો એસિડની ઉપલબ્ધતા પણ રહે છે. ભોજનમાં પાચક રસો ભળતા અન્નનું પાચન સારું થાય છે અને ડાયાબિટીશ જેવા અનેક રોગોની શક્યતાઓ ઓછી થઈ જાય છે.

\* ગ્લુકોઝ અને રાત્રિબોજન :- રાત્રિબોજનના કારણે શરીરમાં એન્જાઈમ પ્રાણાલી સક્રિય નથી રહેતી. તેનાથી ગ્લાઇકોજીન તૂંઠે ગ્લુકોઝમાં પરિવર્તિત નથી થઈ શકતા. પરિણામે અનેક રોગોના હુમલા શરૂ થઈ જાય છે. અને અંગોપાંગ, ત્વચા, હાડકાઓ, હદય, સ્નાયુઓ, પેન્કીયાઝ, કિડની, ફેકસાં, મસ્તક અને ગ્રંથિઓ પર ઘાતક પ્રભાવ પેડે છે.

\* એસીડીટી અને રાત્રિબોજન :- રાત્રિબોજન કરવાથી હાઇડ્રોક્લોરિક એસિડ જેવા રસોનો આવ વધુ થાય છે. તેથી એસીડીટીની તકલીફ થાય છે.

\* વૃદ્ધાવસ્થા અને રાત્રિબોજન :- દિવસે + રાત્રે સતત ખાતા-પીતા રહેવાથી શારીરિક કોષિકાઓ વૃદ્ધિ પામે છે. જેના પરિણામે, વૃદ્ધાવસ્થા કુલી જણાવા લાગે છે.

રાત્રિ દરમિયાન પેટ ખાલી રાખવાથી આંતરડાની સંપૂર્ણ સફાઈ થઈ જાય છે. રાતે ભૂખ્યા રહેવાથી શરીર કમજોર નથી થતું, પરંતુ તાજું થઈ જાય છે. શારીરની કાર્યપ્રાણાલી સક્રિય અને સુઢોળ બને છે. પરિણામે લાંબુ ઘૌંઘન માણી શકાય છે.

\* ફીટનેસ અને રાત્રિબોજન :- રાત્રિબોજન ન કરવાથી લોહીમાં રહેલા ફેનાસાઈટ્સ અને લીઝ્ફોસાઈટ્સ કણોની ક્ષમતામાં અત્યંત નોંધપાત્ર રાતે ખાતાં પહેલાં \_\_\_\_\_ ૪ \_\_\_\_\_



વૃદ્ધિ થાય છે. તેનાથી શરીરનું રોગપતિરોધક તંત્ર શક્તિશાળી બને છે. રાત્રિભોજન ન કરવાથી જલ્દી સૂવાની અને જલ્દી ઉઠવાની ટેવ પડી શકે છે. તેનાથી મસ્તકને સંપૂર્ણ આરામ મળે છે. હથય અને નાડીની ગતિ સામાન્ય રહે છે. લિવરમાં રક્તમવાહ નોર્મલ રહે છે. માનસિક તાણ દૂર થઈ જાય છે.

**\* પ્રકૃતિ અને રાત્રિભોજન :-** રાત્રિભોજન એ એક પ્રકારનું સૂષ્ઠિવિરોધી કાર્ય છે. દિવસે ભોજન વગેરે પ્રવૃત્તિ કરવી અને રાતે નિવૃત્તિ લેવી એ પ્રકૃતિનો શાશ્વત સિદ્ધાન્ત છે. આનાથી વિપરીત કરવામાં આવે, જેમ કે, દિવસે સૂર્ય જવામાં આવે અને રાતે જગવામાં આવે, તો ઘણા રોગો થાય છે. એમ આયુર્વેદથી માંડીને આધુનિક ફિલ્ઝિકલ સાયન્સ સ્વીકારે છે. આ જ રીતે ભોજનની બાબતમાં પણ સમજવું જોઈએ. પ્રકૃતિમાં જે ઉત્તમ જાતના પશુ-પંખીઓ છે, તેઓ રાતે ખાતાં નથી. પંખીઓ દિવસે ચાળીને સાંજે માળામાં પાછા ફરતાં હોય છે, એવું આપાંગે રોજ જોઈ શકીએ છીએ. આપણા હજારો વર્ષોના ઈતિહાસમાં એક ઘટના સામાન્ય છે. ગાયોના ઘણ સવારે ગોચર તરફ જતાં હોય અને સાંજે પાછાં ફરતાં હોય. ધુવડ, ચામાચિડિયા, સાપ વગેરે હુલકી જાતિના પશુ-પંખીઓ જ આમાં આપવાદ છે. માટે જ રાત્રિભોજન સજ્જાય નામની કૃતિમાં કહ્યું છે -

ઉત્તમ પશુ-પંખી જે રાત્રિ ટાલે ભોજન ટાણો ।

તમે તો માનવ નામ ધરાવો કિમ સંતોષ ન આણો ? ||૫||

### \* પારિવારિકજીવન અને રાત્રિભોજન

રાતે જમવાનું મોંડું પતે એટલે બાકીનું ઘરકામ પણ મોંડું પતે. કયારેક આ બાબતે ગૃહુકલેશ પણ થાય. (ઘરના પુરુષસભ્યો અને સ્ત્રીસભ્યો વચ્ચે ખટરાગ થાય.) સૂવાનું પણ મોંડું થાય.

આની બદલે સાંજે છ વાગ્યા સુધીમાં જમીને અને એ પછીના કલાકમાં ઘરકામ કરીને પારિવારના બધા સભ્ય પરવારી જાય એટલે આખું ઘર હળવાશ



અનુભવે. એક-બીજા સાથે જોઈથી હળી-ભળી શકે. બાળકો સાથે મનગમતી પ્રવૃત્તિ કરવાનો પૂરતો સમય રહે. સુખી-સ્વસ્થ કુટુંબ માટે આનાથી રૂં બીજું શું હોઈ શકે ?

## \* પર્સનલ ઓપરિયન્સ અને રાત્રિબોજન

મને છેદ્ધા ત્રીશ વર્ષથી રાત્રિબોજન ત્યાગ છે. ઈન્ડિયામાં હોઉં ત્યારે પણ અને ફોરેનમાં હોઉં ત્યારે પણ. સાંજ પહેલા જમી લેવાની આદતને લીધે ત્રીસ વર્ષથી મારે કચારેચ ઢવા લેવાનો વારો આવ્યો નથી. દિવસનાં ૧૪-૧૫ કલાક કામ કરું, પરંતુ કદી થાક લાગતો નથી. માનસિક શાંતિ મળે. જેનો સીધો લાભ સાંસારિક જીવન અને વેપારમાં પણ મળે.

- રમેશભાઈ શાહ, સોની-મોની ઈલેક્ટ્રોનિક્સ શો રૂમ, મુંબઈ

હું બે વાર જમું છું. સવારે આઠ વાગે અને સાંજે ચાર વાગે. છેદ્ધા ભત્રીશ વર્ષથી આ કમ અકબંધ છે. પરિણામે મારું શરીર તદ્દન નીરોગી અને તંદુરસ્ત છે.

- રમણીકભાઈ ગાડા, ગોરેગામ (પૂર્વ), મુંબઈ

## \* મેડિકલ સાયન્સ અને રાત્રિબોજન

મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત મેડિકલ કોલેજના લેક્ચરર ડૉ. યુવરાજ ભોસલે આ વિષયમાં જાણાવે છે કે -

“આપણા શરીરની બાયોલોજીકલ કલોક એટલે કે જૈવિક ઘડિયાળ સૂર્યના ઉદ્ય-અસ્ત અનુસાર ગોઠવાયેલી હોય છે. સૂર્ય મધ્યાન્ને તપતો હોય, ત્યારે પેટમાં જરાંશિ પણ એની ચરમ સીમાએ હોય. ટૂંકમાં, બપોરે બાર વાગ્યે ભારે ખોરાક ખાઈ શકાય. તબીબી વિજ્ઞાન આ જ તર્કને આગળ વધારીને કહે છે કે રાતે સૂવાના ઓછામાં ઓછા બે થી ત્રણ કલાક પહેલાં જમી લેવું જોઈએ. જેથી આડા પડીએ એ પહેલા ખોરાક પચી ગયો હોય.

મોડી રાતે જમવાની ટેવ વાળા લોકોને વખત જતાં ગેસ્ટ્રો ઈસોફેગાલ રિફલક્સ ડિસીઝ (GERD) તરીકે ઓળખાતો રોગ થાય છે. આ રોગને રાતે ખાતાં પહેલાં \_\_\_\_\_ ૬ \_\_\_\_\_



કારણે હાર્ટબર્ન અને છાતીની પાછળના હાડકાંમાં ભળતરા થાય છે. ઈસોફેગાસ (અન્નણી) માં સોજો પણ ચે છે.

પેટની ઉપર અન્નણી અને નીચે નાનું આંતરડું હોય છે. રાતે જમીને તરત સૂઈ જઈએ તો ખોરાક પચાવવા માટે પેટમાં ઝરેલો એસિડ ઉપરના કે નીચેના અવયવોમાં પેસીને એમાં ક્ષતિ પહોંચ્યેદે છે. મોડી રાતે જમવાનું ચલાણ વધતું જાય છે, એની સાથે અન્નણીના કેન્સર વધતાં જાય છે.”

### \* હંદ્યરોગ અને રાત્રિબોજન

અમદાવાદના જાણીતો ડૉ. વી.એન. શાહ જીવનશૈલીને લગતા રોગો વિષે સંશોધન કરી રહ્યા છે. તેઓ કહે છે કે -

“હંદ્યરોગના હુમલાના મોટા ભાગના કેસમાં સાંજે અથવા પરોછિયે એટેક આવ્યાનું જોવા મળ્યું છે. જે સૂચવે છે કે રાત્રિબોજન બાદ એટેક આવ્યો હતો. એના મૂળમાં ભલે અનેક કારણો હશે, પણ એક કારણ એ તો ખરું જ કે રાતે અપચાને કારણો પેદા થયેલો ગેસ એટેક તરફ દોરી ગયો. હુંગકોંગ-ચીનમાં થયેલા તાજેતરનાં સંશોધન પણ સાબિત કરે છે કે નિયમિત વહેલી સાંજે ભોજન લેનારને હંદ્યરોગનો હુમલો આવવાની શક્યતા ઓછી રહે છે.

રાત્રિના જમણ-પ્રસંગોમાં પચવામાં ભારે હોય એવી વાનગીઓ વધુ પીરસવામાં આવે છે. બર્થ-ડે પાર્ટીમાં કેકનો ટુકડો આરોગો તો એમાંથી પાંચસો કેલરી મળે. પિઝામાંથી આઠસો કેલરી મળે. આ વધારાની કેલરી વાપરવા માટે પૂરતો શ્રમ થતો નથી. એથી આ વધારાની કેલરી ડાયાબિટીસ, હંદ્યરોગ કે બ્લટ ગ્રેશરની બિમારી નોતરી શકે.

### \* આયુર્વેદ અને રાત્રિબોજન

આયુર્વેદમાં આપણી હોજરીને કમળની ઉપમા આપી છે. કારણ કે સૂરજ ચડતો જાય તેમ તેમ આપણી હોજરી ખીલે છે. અને સૂરજ ઢળતો જાય તેમ તેમ આપણી હોજરી સંકોચાય છે. ખીલેલી હોજરીમાં નાંખેલું ભોજન સારી રીતે પચે છે. તેનાથી આરોગ્ય સારું રહે છે. સંકોચાયેલી



હોજરીમાં ગયેલું અને ભરાબર પચતું નથી. યા અનો ‘આમ’ થઈ જાય છે, શરીરના જુદા જુદા અવયવોમાં એ કચરા રૂપે જામ થઈ જાય છે અને યા તો એ આંતરડાઓનો બોજો થઈ પડે છે. માટે જ આયુર્વેદમાં કહ્યું છે - **હૃન્નાભિપદ્મસઙ્કોચ-ચણ્ડરોચિરપાયતः ।**

અતો નક્ત ન ભોક્તવ્યં, સૂક્ષ્મજીવાદનાદપિ ॥

સૂર્યની વિદાયને કારણે હૃદયકમળ અને નાભિકમળ સંકોચાઈ જાય છે. માટે રાતે ન ખાવું જોઈએ. રાતે ભોજનમાં સૂક્ષ્મ જીવો ભળતાં હોય છે. માટે પણ રાતે ન ખાવું જોઈએ.

## \* મોર્ડન સાયંન્સ અને રાત્રિબોજન

સાયંન્સનો એક પ્રિન્સીપલ છે - Where there is darkness there are germs - જ્યાં અંધારું હોય છે, ત્યાં કીટાણુંઓ હોય છે. આ પ્રિન્સીપલ મુખ કરે છે કે રાતે એન્વાયરમેન્ટ કીટાણુયુક્ત હોય છે. આ સમયે કાંઈ પણ ખાવા-પીવામાં હેલ્થ-રિસ્ક રહેલું છે. મકાશનું એક પણ આર્ટિફિશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ સૂરજનું સ્થાન લઈ શકે તેમ નથી. આથી ઉલ્ટું ઈલેક્ટ્રીક લાઈટથી વધુ કીટાણુઓ આવતા હોય છે, એવો આપણાં એક્સપ્રીયન્સ છે. કેટલીય વાર મોટા ઇન્સેક્ટ્સ પણ પેટમાં જતાં રહે છે. અને પરિણામે વોમિટથી માંડીને ઓપરેશન સુધીના કષો ભોગવવા પડે એવા બનાવો બન્યા કરે છે. જે માઈકો ઇન્સેક્ટ્સ પેટમાં જાય છે અને હેલ્થને ડિસ્ટર્બ કરે છે તેમનાથી બયવા તો તે-લાઈટમાં જ ખાવું, એ જ એક પ્રિવેન્શન બચી શકે છે. We know, Prevention is better than cure. ફેરેનમાં ઘણા સર્જન ડોક્ટર્સ મેજર ઓપરેશન દિવસે જ કરે છે. જેનું રિઝન પણ આ જ છે - માઈકો ઇન્સેક્ટ્સ.

## \* યોગશાસ્ત્ર અને રાત્રિબોજન

જુદાં જુદાં કીટાણુ રાત્રિબોજન દ્વારા આપણા શરીરમાં પ્રવેશો ત્યારે કેવી કેવી ઈંકિકટ કરે, તે વિષે યોગશાસ્ત્રમાં કહ્યું છે - સેધાં પિપીલિકા હન્તિ - ક્રીડીથી માઈન્ડ-પાવર ઓછો થાય છે. યૂકા કુર્યાજલોદરમ - રાતે ખાતાં પહેલાં



‘જુ’ થી જલોદર રોગ થાય છે. કુરુતે મધ્યિકા વાન્તિમ् - માઘીથી વોમિટ થાય છે. કુષ્ઠરોગં ચ કોલિકઃ - કરોળિયાથી કોણ રોગ થાય છે. કણટકો દારુખણ્ડં ચ વિતનોતિ ગલવ્યથામ् - કાંટો કે લાકડાનો ટુકડો ગળામાં પીડા કરે છે. તાલુ વિધ્યતિ વૃશ્ચિકઃ વીંધી તાળવાને વીંધી હે છે. વિલમ્બશ ગલે વાલ: સ્વરભઙ્ગાય જાયતે - ગળામાં લાગેલો વાળ સ્વરભંગ કરે છે.

### \* વૈદિક વિજ્ઞાન અને રાત્રિભોજન

વેદો રાત્રિભોજનનો નિષેધ કરે છે. તે આ પ્રમાણે -

દેવैસ્તુ ભુક્ત પૂર્વાહણે, મધ્યાહને ઋષિભિસ્તથા ।

અપરાહણે તુ પિતૃભિઃ, સાયં ભુજ્જન્તિ દાનવાઃ ॥

સન્ધ્યાયાં યક્ષરક્ષોભિઃ, સદા ભુક્ત કુલોદ્વહ ! ।

સર્વવેલાં વ્યતિક્રમ્ય, રાત્રૌ ભુક્તમભોજનમ् ॥

- યજુર્વેદ આન્તિક શ્લોક ૨૪-૧૮

દેવોએ પ્રભાતે ભોજન કરેલું છે. ઋષિ મુનિઓએ બપોરે, પિતૃઓએ બપોર પછી, દૈત્ય-દાનવોએ સાંજે અને યક્ષ-રાક્ષસોએ સંધ્યા સમયે ભોજન કરેલ છે. આ બધાં સમયને છોડીને રાત્રિભોજન કરવામાં આવે તે અભોજન = ખરાબ ભોજન છે.

### \* પુરાણો અને રાત્રિભોજન :-

અઢાર પુરાણોમાંથી અનેક પુરાણોમાં રાત્રિભોજન ન કરવા માટે ભારપૂર્વક ભલામણ કરેલી છે. તે આ મુજબ - પદ્મપુરાણના પ્રભાસખંડમાં કહું છે - ચત્વારો નરકદ્વારાઃ, પ્રથમં રાત્રિભોજનમ् ।

પરસ્તીગમનં ચૈવ, સન્ધાનાનન્તકાયિકે ॥

નરકના ચાર દરવાજા છે. (૧) રાત્રિભોજન (૨) વ્યભિચાર (૩) બોળઅથાણુ\* (૪) કંદમૂળ ભક્ષણ<sup>+</sup>

\* એવું અથાણુ જેમાં પાણીનો અંશ રહી જવાથી સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થઈ ગયા હોય. + કંદમૂળ ઓટલે કાંદા, બટેટાં, ગાજર, લસણ, મૂળા, પ્યાજ, સૂરણ વગેરે. તેમાં અનંત જીવો હોય છે.



માર્કિંગપુરાણમાં કહ્યું છે - અસ્તંગતે દિવાનાથે, આપો રુધિરમુચ્યતે ।  
અન્ન માંસસમં પ્રોક્તં, માર્કડેયમહર્ષિણા ॥

સૂર્યાસ્ત બાદ પાણી એ લોહી છે અને અન્ન એ માંસસમાન છે,  
એવું માર્કિંગ મહર્ષિણે કહ્યું છે.

નોદકમપિ પાતવ્યં, રાત્રાવત્ર યુધિષ્ઠિર ! ।  
તપસ્વિના વિશેષેણ, ગૃહિણા ચ વિવેકિના ॥

હે યુધિષ્ઠિર ! રાતે પાણી પણ ન પીવું જોઈએ. મુનિએ અને વિવેકી  
ગૃહસ્થે આ વાતનો ખાસ ઘ્યાલ રાખવો જોઈએ.

૨૫૬ પુરાણમાં કહ્યું છે -

એકભક્તાશનાન્ત્રિત્ય - મન્મિહોત્રફળં લભેત् ।  
અનસ્તભોજનો નિત્યં, તીર્થયાત્રાફળં લભેત् ॥

રોજ એક જ વાર ભોજન (એકટાણ) કરે, તે અણિહોત્રના ફળને  
પામે છે અને જે માનવ હુંમેશા સૂર્યાસ્ત પૂર્વે જ ભોજન કરે છે તેને તીર્થયાત્રાનું  
ફળ મળે છે.

ત્વયા સર્વમિદं વ્યાસં, ધ્યેયોऽसિ જગતાં રવે ! ।  
ત્વયિ ચાસ્તમિતે દેવ !, આપો રુધિરમુચ્યતે ॥

હે સૂર્યદિવ ! આપનાથી આ બધું વ્યાસ છે. જગતના લોકો આપનું  
ધ્યાન કરે છે. આપ અસ્ત પામો એટલે પાણી લોહી કહેવાય છે.

\* યોગવાશિષ્ઠ અને રાત્રિભોજન :-

નક્તં ન ભોજયેદસ્તુ, ચાતુર્માસ્યે વિશેષતઃ ।

સર્વકામાનવાપ્નોતિ, ઇહલોકે પરત્ર ચ ॥૧૦૮॥ પૂર્વાર્થ

જે રાત્રિભોજન ન કરે અને યોમાસામાં ખાસ આ વાતનો ઘ્યાલ  
રાખે, તે આ જન્મમાં અને બીજા જન્મોમાં સર્વ ઈચ્છિત વસ્તુઓને પામે છે.



## \* મહાભારત અને રાત્રિભોજન :-

મદ્યમાંસાશનં રાત્રૌ, ભોજનં કન્દભક્ષણમ् ।

યે કુર્વન્તિ વૃથાસ્તેષાં, તીર્થયાત્રા જપસ્તપ: ॥

જેઓ દાડુ પીવે છે, માંસ કે કંદમૂળ ખાય છે, અથવા રાત્રિભોજન કરે છે, તેમની તીર્થયાત્રા, તપ અને જપ નિષ્ફળ થાય છે.

રક્તિભવન્તિ તોયાનિ અન્નાનિ પિશિતાન્યપિ ।

રાત્રૌ ભોજનસક્તસ્ય ગ્રાસે તન્ માંસભક્ષણમ् ॥

રાતે પાણી લોહી બની જાય છે અને અને માંસ બની જાય છે.  
માટે રાતે ભોજન કરવું તે માંસ ખાવા સમાન છે.

## \* રામાયણ અને રાત્રિભોજન :-

વનવાસ દરમિયાન શ્રીરામ, શ્રીલક્ષ્મણ અને સીતાજી દક્ષિણાપથ તરફ જઈ રહ્યા હતાં. વર્ષે કુબરનગર આવ્યું. ત્યાં મહીધર રાજાની પુત્રી વનમાલા સાથે લક્ષ્મણજીએ લગ્ન કર્યા. હવે તેઓ આગળ પ્રયાણ કરવાના હતા. વનમાલાને ચિંતા થઈ, જો તેઓ મને લેવા નહીં આવે તો ? લક્ષ્મણજીએ તેને વચ્ચન આપ્યું. ‘હું જરૂર પાછો આવીશ. જો પાછો ન આવું તો મને હૃત્યારાની ગતિ મળજો. (નિર્દોષને મારી નાખનાર જે ગતિમાં જાય, તે ગતિ મને મળજો) બસ ?’ વનમાલા ના પાડે છે. લક્ષ્મણજી હવે બીજા શપથ લે છે, ‘ન આવું તો મને ચોરની ગતિ મળજો. હવે સંતોષ ?’ વનમાલા ચૂપ છે. લક્ષ્મણજી કહે છે, ‘તો હવે તું જ કહે, હું કેવી શપથ લઉં ?’ વનમાલા કોમળ સ્વરથી કહે છે, ‘જો આપ પાછા ન આવો, તો રાત્રિભોજન કરનાર જે ગતિમાં જાય, તે ગતિ આપની હો, એવી શપથ લો, તો જ મને સંતોષ થશો.’

શ્રૂયતે હાન્યશપથાન્, અનાદૃત્યૈવ લક્ષ્મણ: ।

નિશાભોજનશપથં, કારિતો વનમાલયા ॥



લક્ષ્માગજાએ એવી શપથ લીધી અને પછી વનમાલાએ એમને પૂરા વિશ્વાસ સાથે રજા આપી, કે હવે એ પાછા આવશે જ.

\* રિકાર્નેશન અને રાત્રિભોજન :- પૂર્વજન્મ-પુનર્જન્મ એ હવે એક પુરવાર થયેલી વસ્તુ છે. સેંકડો રિકાર્નેશન કેસોનો અભ્યાસ કરીને અનેક સાયન્ટિસ્ટ્સ, ડોક્ટર્સ અને અન્ય એજ્યુકેટેડ લોકોએ આ પ્રિન્સીપલને મુવા કર્યો છે. રાત્રિભોજન કરવાથી કઈ ગતિ મળે એ અંગે ચોગશાસ્ત્રમાં કહ્યું છે - ઉલ્લૂકકાકમાર્જાર-ગૃધ્રશમ્બરશૂકરા: ।

અહિવૃશ્શિકગોધાશ્ર, જાયન્તે રાત્રિભોજનાત् ॥

રાત્રિભોજન કરનારને ધુવડ, કાગડાં, બિલાડી, ગીધ, સાબર, ભૂંડ, સાપ, વીંછી અને ઘો (ચંદન ઘો/પાટલા ઘો જેવા નામોથી ઓળખાતું ગ્રાણી) - આવા જન્મો લેવા પડે છે.

તે અવતારોમાં તે જીવ ફરી તેવા પાપો કરે છે અને તેવા કે તેથી પણ નીચ અવતારો પામે છે.

\* ભગવાન શ્રીમહાવીરસ્વામી અને રાત્રિભોજન :-

જૈન આગમોભાં રાત્રિભોજનનો સ્પષ્ટ નિષેધ કરેલ છે -

એયં ચ દોસં દદ્દુણં, નાયપુત્રેણ ભાસિયં ।

સબ્વાહારં ન ભુંજંતિ, નિગંથા રાઇભોયણં ॥

આ બધાં દોષોને પોતાની સર્વજ્ઞાદિથી જોઈને ભગવાન શ્રીમહાવીરસ્વામીએ કહ્યું છે કે - રાતે અત્ર, જળ, ફળ કે મુખવાસ સુદ્ધા પણ ન લેવા જોઈએ.

તેમણે પોતાના જીવનમાં આ સિક્ષાન્તનો યુસ્ત અમલ કરેલ. તેમના ઉપદેશને સ્વીકારીને આજે પણ દુઃખરો સાધુ-સાધ્વીજી સૂર્યાસ્ત બાદ યુસ્તપણે રાત્રિભોજનત્યાગ કરે છે અને ગમે તેવી ગરમીની સિજનમાં પણ રાતે પાણીનું દીપું પણ લેતા નથી. લાખો જૈનો સૂર્યાસ્ત પૂર્વ ભોજન કરી લે છે. અને રાતે ખાતાં પહેલાં \_\_\_\_\_ ૧૨ \_\_\_\_\_



પદ્ધી સૂર્યોદય બાદ ૪૮ મિનિટ થાય પદ્ધી જ અત્ર ગ્રહણ કરે છે. વધુ ચુસ્ત જૈનો ગૃહસ્થજીવનમાં ય રાતે પાણીનું ટીપું સુદ્ધા પણ લેતા નથી. અહિંસા પરમો ધર્મઃ - આ સર્વ ધર્મનો સિક્ષાન્ત છે. જૈનું જૈન ધર્મમાં જીવંત દર્શન થાય છે. રાત્રિભોજનમાં સહજ સંભવિત હિંસાઓને ટાળવા માટે જૈનો રાત્રિભોજનનો ત્યાગ કરે છે. જૈન શાખોમાં રૂ અભક્ષય (નહીં ખાવા યોગ્ય વસ્તુઓ) કર્યા છે. તેમાં ચૌદમાં અભક્ષય તરીકે રાત્રિભોજન જગ્યાવેલ છે.

### \* ભગવાન શ્રીગૌતમબુદ્ધ અને રાત્રિભોજન :-

બૌધ્ધ ધર્મનો આદિ ગ્રંથ ત્રિપિટક છે. તેમાં પાલી ભાષામાં કહ્યું છે -

રત્ન વિકાલભોજન પયહેઠથા ।

રાત્રિભોજન - સૂર્યાસ્ત પદ્ધીના ભોજનનો ત્યાગ કરો.

### \* રિસેપ્શન અને રાત્રિભોજન :-

નાઈટ રિસેપ્શન-સમાં જાતજાતના જીવાં ભોજનમાં ભળતાં હોય, જાહેર સ્થાનો કે ખુલ્લા સ્થાનોમાં આ સંભાવનાના ગુણાકાર થતાં હોય અને ખાધાં પદ્ધી વોમિટ, ડાયેરિયા કે ફૂડ પોર્ટિજન ઈફેક્ટ્સ થઈ હોય, તેવી ઘટનાઓ છાશવારે બનતી રહે છે. ક્યારેક ભોજન માટે ફરતાં સાપનું ઝેર ભોજનમાં ભળી ગયું હોય ને તેનાથી લગ્નની આખે આખી જાન મૃત્યુ પામી હોય તેવા કિસ્સા પણ બન્યા છે. કેટરસના માણસોની એક્સટ્રીમ બેદરકારીથી શાકભાજી વગેરેની સાથે સાથે જ કીડી, મકોડા, વાંદા, ઈયળ, ગરોળી, દુડકાં, ઉંદર અને નાના સાપ સુદ્ધાં કપાઈને રંધાઈ જતાં હોય છે. સહજ રીતે આ બધી સંભાવનાઓ રાતે ઘણી વધી જાય છે. આ બધી તકલીફોથી બયવા માટે તે ભોજન ન લેવું - તે જ એક સીધો અને સરળ ઉપાય બની રહે છે.

### \* ફાસ્ટ ફૂડ અને રાત્રિભોજન :-

રિસેપ્શન માટે જે વાત કરી, એ જ વાત ફાસ્ટફૂડને પણ એટલી



જ લાગુ ફે છે. માટે જવદયામાં માનનારી વ્યક્તિ રેસ્ટોરન્ટ, લારી, પેક કુડ વગેરેથી દૂર રહે તો જ તે વેળુટેરિયન રહી શકે. ભોજન સાથે જ્યારે ધંધો જોડાય છે ત્યારે વાસી, સહેલું, ગંદામાં ગંદું ભોજન પણ કોઈ ફેંકી દેતું નથી, પણ એને શાશગારીને ઘરાકને પધરાવી દેવામાં આવે છે. બાકીનું કામ રાતનો સમય પૂરું કરી હે છે. જવદયામાં ન માનનાર પણ પોતાની જાતની દયામાં તો માનતા જ હોય છે. માટે સારી હેલ્થ જોઈતી હોય, તેણે દિવસે ઘરે કાળજીપૂર્વક બનાવેલું તાજું ભોજન લેવું- એ જ એક વિકલ્પ અપનાવવાનો રહે છે. આપણે ત્યાં કહેવત પણ છે -

તાજુ ખાય, વખતસર સૂવે, એનો રોગ, ધુસકે રુવે.

બહારનું ખાનારા તાજુ ખાઈ શકતાં નથી અને રાત્રિભોજન કરનારા વખતસર સૂઈ શકતા નથી. માટે ઘરે જ + દિવસે જ ← આ બે વસ્તુ જરૂરી બની જાય છે.

### \* જીવનદિષ્ટ અને રાત્રિભોજન :-

જીવન ટકે એ માટે ખાવાનું છે. પણ ખાવા માટે જીવવાનું નથી. જીવનનું લક્ષ્ય ‘ખાવું’ એ નથી. ભોજન તો ધણી તુચ્છ વસ્તુ છે. તે માત્ર એક સપોર્ટર છે, ટેકો છે. તેના સપોર્ટથી આપણે જીવનના ઉચ્ચ લક્ષ્યને પામવા માટે પ્રયાસ કરવો જોઈએ. જે આરોગ્યને હાનિકારક છે એ ખોરાક લેવો, એ તો ટેકાને બોજો બનાવી દેવાની ચેષ્ટા છે. એનાથી આપણે ઊંચે ચડવાને બદલે નીચે પડી જઈશું. પશુઓ માત્ર ભોજનના જ લક્ષ્યથી તેમની મોટા ભાગની જિંદગી પસાર કરતાં હોય છે. આપણે તેમના જેવા નથી. તેમના જેવા થવા જેવું પણ નથી.

### \* પાચનતંત્ર અને રાત્રિભોજન :-

રાતે જમનાર વ્યક્તિ દિવસમાં પણ ૨/૩/૪ વાર તો ખાતી જ હોય છે. જેમ દિવસે કામ કર્યા બાદ રાતે આપણા શરીરને આરામ જોઈતો હોય છે. તે જ રીતે આપણા પાચનતંત્રને પણ આખો દિવસ કામ કર્યા બાદ રાતે ખાતાં પહેલાં \_\_\_\_\_ ૧૪ \_\_\_\_\_



રાતે આરામ જોઈતો હોય છે. રાતે ખાવાથી પાચનતંત્ર પર વધારાનો કામનો બોજો આવે છે. એ ચૂપચાપ એનું કામ કર્યા કરે છે. પણ એક દિવસ એ થાકે છે. જાતજાતના રોગો દ્વારા એ પોતાનો જવાબ આપે છે. એના લાંબા કામનો બદલો એ આપણી જુવાની ટૂંકાવીને લે છે. ઓછું ખાવું, ઓછી વસ્તુઓ ખાવી અને ઓછી વાર ખાવું એ હેઠળી લોંગ-લાઈફનું સિકેટ છે. We can see, તપસ્વી વ્યક્તિ બીજાં કરતાં વધુ તંકુરસ્ત હોય છે.

### \* રાત્રિભોજનના ફાયદા :-

દરેક વસ્તુની જેમ બીજુ બાજુ હોય છે, તેમ રાત્રિભોજનમાં આટઆટલાં નુકશાનો સાથે અમુક ફાયદા પણ રહેલાં છે. પણ આ ફાયદા રાત્રિભોજન કરનારને નથી મળતાં, બીજાને મળે છે. પહેલો ફાયદો હોટલ-લારીવાળાને છે. કારણ કે માણસ કામ-ધંધા વગેરેની વ્યસ્તતાથી પરવારીને રાતે હોટલ-લારીની મુલાકાત લેવા માટે નવરો પડતો હોય છે. એનું રાત્રિભોજન તે તે ધંધાવાળા માટે આશીર્વાદરૂપ બને છે. બીજો ફાયદો ડિસ્પેન્સરીવાળાઓને છે. ત્રીજો ફાયદો મેડિકલ સ્ટોરવાળાઓને છે. ચોથો ફાયદો ડાયગ્રોસ્ટિક સેન્ટરવાળાઓને છે. પાંચમો ફાયદો હોસ્પિટલવાળાઓને છે. કારણ કે એક માણસ બીમાર પે એટલે આમાંથી કોઈને ને કોઈને તો ફાયદો થાય જ છે.

### \* છૂટ્ટસ અને રાત્રિભોજન :-

આરોગ્ય અંગે આપણી સંસ્કૃતિમાં ઘણી લોકોક્રિતો પ્રચલિત છે. તેમાંથી એક આ છે - “ફળ સવારે ખાવાથી હીરા જેવું, બપોરે ખાવાથી સોના જેવું, સાંજે ખાવાથી ચાંદી જેવું અને રાતે ખાવાથી લોખંડ જેવું બને છે.” અર્થાત્ રાતના કરતો ફળાહાર આરોગ્ય માટે દુનિકારક છે.

### \* સાર :-

સાર એ છે કે વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક બંને દિલ્લિએ રાત્રિભોજન ત્યાજ્ય છે. જે વસ્તુ દુનિયાના બીજા કોઈ જીવ માટે સારી નથી, જે બીજાને



હાનિકારક હોય છે, તે આપણા પોતાના માટે પણ સારી નથી જ હોતી.  
સહુના સુખમાં આપણું સુખ છે - આ વાસ્તવિકતાને આપણે સાકારરૂપે  
જોઈ શકીએ છીએ. જીવદ્યાની દસ્તિએ રાત્રિભોજન છોડી દેનાર હુકીકતમાં  
પોતે જ ઘણા કુઃખોથી છૂટી જાય છે. This is the fact, Now what  
to do, that's the matter of your wish.

